

## OMKAR OVERSEAS LIMITED

Registered Office- 212, New Cloth Market, O/S. Raipur Gate, Raipur, Ahmedabad – 380 002

Phone No.: 91-79-22132078

E - mail: [omkaroverseas212@gmail.com](mailto:omkaroverseas212@gmail.com)

Website: [www.omkaroverseasltd.com](http://www.omkaroverseasltd.com)

CIN: L51909GJ1994PLC023680

OOL /SE/2021-22/P40

February 16, 2022

To,  
The Manager, Listing  
**BSE Limited**  
Phiroze Jeejeebhoy Towers,  
Dalal Street,  
Mumbai- 400001

Dear Sir/Madam,

**Sub: Publication of Unaudited Standalone Financial Results for the Third Quarter and Nine Months ended as on 31<sup>st</sup> December, 2021.**

**Ref: Company Code: BSE: 531496**


With regard to above and in compliance with the Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of Financial Express English & Jai Hind Gujarati edition dated 13<sup>th</sup> February, 2022 in which Unaudited Standalone Financial Results for the Third Quarter & Nine Months ended as on 31<sup>st</sup> December, 2021 as approved in the meeting of the Board of Directors held on 12<sup>th</sup> February, 2022 were published.

You are requested to please take note of same.

Thanking You,

Faithfully Yours,

**FOR OMKAR OVERSEAS LIMITED**



**RAMESH DEORA**  
**DIRECTOR & CEO**  
**DIN : 01135440**



**Encl: As Stated**

**AXTEL INDUSTRIES LIMITED**

Regd. Office: Vadodara - Halol Highway, Baska, Panchmahal, Gujarat  
Tel # (02676)247140,247141,247175,247177 Fax # +91 (2676) - 247125  
E-mail : info@axtelindia.com Website : www.axtelindia.com CIN : L91110GJ1991PLC016185

**Extract of unaudited financial results for the quarter ended 31st December 2021**

(RS. IN LAKHS)

Sr. No.	Particulars	Quarter Ended 31/12/2021 (Unaudited)	Previous Year Ended 31/03/2021 Audited	Corresponding Quarter Ended 30/09/2021 (Unaudited)
1.	a- Sales/Income from Operations	3,799.28	15,339.47	2,649.83
	b. Other Income	20.30	313.63	181.08
2.	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	272.31	2,886.65	301.92
3.	Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	272.31	2,886.65	311.76
4.	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	193.95	2,129.45	205.96
5.	Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax))	192.17	2,122.34	204.18
6.	Equity share capital:	1,615.48	1,615.48	1,615.48
7.	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) - Not Annualised			
	a. Basic -Rs.	1.20	13.18	1.27
	b. Diluted -Rs.	1.20	13.18	1.27

**Notes :**

1. The above is an extract of the detailed format of Financial Results prepared in accordance with IND-AS- as prescribed u/s 133 of the Companies Act, 2013, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results are available on the Bombay Stock Exchange website. [www.bseindia.com](http://www.bseindia.com) and company's website [www.axtelindia.com](http://www.axtelindia.com)

for AXTEL INDUSTRIES LIMITED

Ajay Parikh  
Executive Director  
DIN-00453711

Place : Village Nurgpura  
Date : 12<sup>th</sup> February, 2022

**BEFORE NATIONAL COMPANY LAW TRIBUNAL, BENCH, AT AHMEDABAD**  
Pursuant to Section 230(3) and Rule 16 of Companies Act, 2013  
Company Petition C.P. (CAA) No. 11/2022 in C.A. (CAA) No.73/NCLT/AHM/2021  
Applicant Deregulated Company  
Applicant Resulting Company  
Applicant Deregulated Company  
Applicant Resulting Company  
Applicant Deregulated Company  
Applicant Resulting Company

**NOTICE OF HEARING OF THE PETITION**  
The above petition for Approval of Scheme of Arrangement involving Demerger between above companies has been admitted by National Company Law Tribunal (NCLT), Ahmedabad Bench Court 1 vide order dated 08/02/2022 and the hearing of the Petition has been fixed on 30/03/2022.

Any person desirous of opposing the said petition should send notice of his intention signed by him or his advocate with his name and address so as to reach the Honourable NCLT Ahmedabad Bench Court 1 at 1st and 2nd Floor, Corporate Bhavan, Beside Zyudus Hospital, Off S G Highway Thaltej, Ahmedabad 380059. The copy of the notice be also sent to the authorised representative of the Petitioner companies Mr. Kunjal Dalal, Practising Company Secretary at 105, Pawanhanish Complex, B/h Chamunda Restaurant, Sub Jail Char Rasta, Ring Road, Surat-395002 so as to reach on or before the date fixed for hearing by the Honourable Tribunal i.e. 30/03/2022.

A copy of the Petition will be furnished by the representative of Petitioner to any person on demand.

Date: 12.02.2022  
Place: Surat  
Sd/-  
PCS Kunjal Dalal  
Authorised Representative of Petitioners  
105, Pawanhanish Complex, B/h Chamunda Restaurant, Sub Jail Char Rasta, Ring Road, Surat-395002. Email: k\_dalal@rediffmail.com | M. No: +91 9227900395

**ZENITH HEALTHCARE LIMITED**

CIN No. : L2431GJ1994PLC023574  
Registered Office : 504, Ison Elegance, Nr. Anandham Jain Derasar, Prahladnagar Cross Road, S.G. Road, Ahmedabad - 380015 Tele No. 079 - 66168889/90, 40095550 Fax No. : 079 - 66168891  
E-mail : mahendrazenith@hotmail.com Website : www.zenithhealthcare.com

**UNAUDITED STANDALONE IND AS COMPLIANT FINANCIAL RESULT FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER, 2021**

(RS. IN LACS)

Sr No	Particulars	Quarter ended 31/12/2021 (Unaudited)	Quarter ended 31/12/2020 (Unaudited)	Nine Months ended 31/12/2021 (Unaudited)	Nine Months ended 31/12/2020 (Unaudited)	Year ended 31/03/2021 (Audited)
1	Total Income from Operations	457.34	337.09	1489.31	1254.62	1420.03
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	10.16	10.51	52.10	69.48	55.81
3	Net Profit / (Loss) for the period before tax (After Exceptional and/or Extraordinary items)	9.81	10.51	51.75	69.48	55.81
4	Net Profit / (Loss) for the period after tax (After Exceptional and/or Extraordinary items)	9.81	10.51	51.75	69.48	43.99
5	Total comprehensive Income for the period	---	15.87	---	92.35	---
6	Equity Share Capital (Face value Rs.1/- each)	537.39	537.39	537.39	537.39	537.39
7	Reserve (excluding revaluation reserve as shown in the balance sheet of previous year)	---	---	---	---	146.97
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operation)	---	---	---	---	---
	- Basic :	0.018	0.030	0.096	0.172	0.082
	- Diluted :	0.018	0.030	0.096	0.172	0.082

**Notes :** (1) The above is an extract of the detailed financial results for the Third Quarter ended 31st December, 2021 filed with the Stock Exchange pursuant to regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the same are available on the website of the Stock Exchange at [www.bseindia.com](http://www.bseindia.com) and also on the Company's web site at [www.zenithhealthcare.com](http://www.zenithhealthcare.com)

For Zenith Healthcare Limited

Place : Ahmedabad  
Date : 11-02-2022  
Sd/-  
Mahendra C. Raycha  
Chairman & Managing Director. DIN: 00577647

**OMKAR OVERSEAS LTD.**

Registered Office : 212, New Cloth Market, O/s, Raipur Gate, Raipur, Ahmedabad - 380002 Ph. No. : 91-79-22132078 CIN : L51909GJ1994PLC023680  
E-mail : omkaroverseas212@gmail.com Website : www.omkaroverseasindia.com

**EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THIRD QUARTER AND NINE MONTHS ENDED ON 31ST DECEMBER, 2021**

(In Lakhs)

Sr No	Particulars	Quarter ended on 31/12/2021 (Unaudited)	Nine Months ended on 31/12/2021 (Unaudited)	Corresponding 3 months ended in the previous year 31/12/2020 (Unaudited)
1	Total Income from Operations	87.23	87.23	0.00
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	3.69	1.37	-9.47
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	3.69	1.37	-9.47
4	Net Profit / (loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	3.35	1.03	-9.47
5	Total Comprehensive Income for the period (Comprising Profit/ (loss) for the period (after tax) and other comprehensive income (after tax)	3.35	1.03	-9.47
6	Paid-up equity Share Capital	492.36	492.36	492.36
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.	-	-	-
8	Earnings per Share (of Rs. 10/- each) (for continuing operations)	0.067	0.021	(0.189)
	(a) Basic	0.067	0.021	(0.189)
	(b) Diluted	0.067	0.021	(0.189)

**Notes :** (1) The above is an extract of the detailed format of quarter and nine months ended Unaudited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The Full format of the unaudited Financial Results is available on the stock exchange website - [www.bseindia.com](http://www.bseindia.com) & on company's website - [www.omkaroverseasindia.com](http://www.omkaroverseasindia.com)  
(2) The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 12th February, 2022.  
(3) The company has adopted Indian Accounting Standard ("IND AS") notified by the Ministry of Corporate Affairs with effect from 1st April, 2017. Accordingly the Financial Result for the third quarter and nine months ended on 31st December, 2021 in accordance with IND-AS and other accounting principles generally accepted in India.  
Place : Ahmedabad For, Omkar Overseas Limited  
Date : 12/02/2022 Ramesh Deora, Director & CEO. DIN : 001135440

**Purity Flexpack Limited**

Regd. Office - AT - VANSETI, POST TAJPUR, NR HALOL DIST.- PANCHMAHAL - PH - 9879508744  
Email : sales@purityflexpack.com www.purityflexpack.com  
CIN - L25200 GJ1988PLC010514

**Extract of Financial Results for the quarter and nine months ended 31 December, 2021**

(₹ in Lacs, except per equity share data)

Sr. No.	Particulars	Quarter ended			Nine Months ended		Year ended 31.03.2021 Audited
		31.12.2021 (Unaudited)	30.09.2021 (Unaudited)	31.12.2020 (Unaudited)	31.12.2021 (Unaudited)	31.12.2020 (Unaudited)	
1	Total Income From Operation.	2,512.58	2,345.71	2,391.19	7,520.24	6,575.45	9,343.31
2	Net Profit / (Loss) for the period (Before Tax and Exceptional items)	(197.24)	14.42	253.63	(69.82)	750.42	1,095.48
3	Net Profit / (Loss) for the period (Before Tax and after Exceptional items)	(197.24)	14.42	253.63	(69.82)	750.42	1,095.48
4	Net Profit / (Loss) for the period (after Tax and Exceptional items)	(171.51)	(12.84)	191.31	(80.14)	561.55	883.84
5	Total Comprehensive income for the period (Comprising Profit / (Loss) of the period (After tax) and other Comprehensive Income (after tax))	(169.03)	(13.78)	190.53	(77.10)	559.45	887.88
6	Paid up equity share capital (Face Value of Rs.10/- each)	107.34	107.34	107.34	107.34	107.34	107.34
7	Reserve (excluding revaluation reserves as per balance sheet)	-	-	-	-	-	3,009.31
8	Earning per share (Face value of Rs. 10/- each) Basic & Diluted ("not annualized")	(15.98)*	(1.20)*	17.82*	(7.47)*	52.32*	82.34

**Notes:**

1. The above is an extract of the detailed format of the Unaudited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the Securities Exchange Board of India (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The Unaudited Financial Results & this extract were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company in its meeting held on 12 February, 2022. The full Format of the Unaudited Financial Results is available on the stock exchange websites, [www.bseindia.com](http://www.bseindia.com) and on the Company's website [www.purityflexpack.com](http://www.purityflexpack.com).

For Purity Flexpack Limited  
Sd/-  
Kunal Patel  
Director (DIN: 00106545)

Place : Vanseti  
Date : 12<sup>th</sup> February, 2022



Regional office Ahmedabad Region II, 1st Floor, Dena Laxmi Bhavan, Ashram Road, Navrangpura, Ahmedabad-380009.  
Tel : 079 26594163  
Email : recovery.ahmedabad2@bankofbaroda.com

**E-AUCTION SALE NOTICE FOR SALE OF CAR UNDER HYPOTHECATION CLAUSE-12 THROUGH**

Notice is hereby given to the public in general and in particular to the borrower(s) and Guarantor(s) that the below described movable vehicles hypothecated/charged to the Bank of Baroda (Erstwhile Dena bank/Erstwhile Vijaya Bank) the physical possession of which has been taken by the Authorized officer of the Bank of Baroda (Erstwhile Dena bank/Erstwhile Vijaya Bank), secured creditor, will be sold on 16.03.2022 on "As is where is", "As is what is" and "Without Recourse Basis" including encumbrances if any for recovery of below mentioned accounts. The auction will be online E auctioning through website <http://bob.auctiontiger.net> (Also on Auction tiger Mobile App)

**Date & Time of E auction: 16-03-2022 from 02.00 PM to 06.00 PM (With unlimited extension of 5 minutes duration each)**

Branch	Name of Borrower	Dues Outstanding	Details of the Vehicles	Reserve Price, EMD and Bid Increase Amount	A/c No. where EMD to be deposited	Inspection Date & Time of the Vehicle	Contact No of the Branch Manager / Authorised officer
Darapur	Harendra Rajendrabhai Mulkerkar	Rs. 4,74,496 + Uncharged Interest + Legal & Other Expenses	Maruti Suzuki India Ltd (Wagon VXi 1.0 L) Colour - Superior White Body Type - Hatch Back Reg No. GJ-27-CM-0732 ENGINE No. K10BN5063900 CHASIS No. MA3JMT31SKB124370	Reserve Price Rs. 2.50 Lacs EMD Rs. 0.25 Lac Bid Inc Rs. 5000/-	A/c No.: 03230015181869 A/c Name : Sarfaesi Auction Proceeds A/C IFSC Code : BARB0DARIAP	25.02.2022 Time 12:30 PM to 2:30 PM	Mr. Sanjeev Sambyal 7574892034 Mr Chirag Chavda 9978446512

**LAST DATE OF DEPOSIT OF EMD & BID : 15.03.2022 UPTO 04:00 P.M.**

All the taxes / GST as per Govt. rules applicable shall be payable by the purchaser on sale of vehicle. (1) For detailed terms & conditions of the Sale, please refer to the link provided in our bank's website at [www.bankofbaroda.com](http://www.bankofbaroda.com) (2) The Auction sale will be Online e-auction / Bidding through website <http://bob.auctiontiger.net>. (Details of vehicle also available on Auction tiger mobile App) on date and time mentioned above with unlimited extension of 5 minutes duration each. (3) In case of technical assistance, bidders may contact Shri Chintan Bhatt (Contact No. 997851888, 079-68136878) or bidder support at 9265562821, 9265562818, 079-6813 6837/80. Email : [gujarat@auctiontiger.net](mailto:gujarat@auctiontiger.net), Website : <https://bob.auctiontiger.net>

Date : 13.02.2022 | Place : Ahmedabad

Authorized Officer, Bank of Baroda



Branch Office : Canara Bank,  
Parle Point Branch, Surat.

**DEMAND NOTICE**

**Notice Under Section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.**  
The Following Borrowers and Co-Borrowers availed the below mentioned secured loans from Canara Bank. The loans of the below mentioned borrowers and co-borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPA as per the RBI guidelines. Amount due by them to Canara Bank are mentioned as per respective notices issued more particularly described in the following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged as per contractual rate with effect from their respective dates.

Loan A/c No. & Loan Limit Type of Loan	Name of Borrower/Co-Borrower and Guarantor	Demand Notice Date & O/s. Amount Rs.	Details of Immovable Property
A/c No. 7177730002164	1. Shyam Becharbhai Bharwad (Borrower) Add.-1: Flat-2, Momai Krupa Building, Noman ni chawl, Sahara Darwaj B/H Umarvada Surat- 395003.	04.02.2022 Rs.20,59,813.25	Immovable property bearing all those pieces and Parcel Immovable property of "A" Type Plot No. 190 of the society known as "Priyanka Mega City" situated at Godadara Naher Road bearing R.S. No. 180/1+2D, 180/1+2, Block no. 182 & 183 paiki, T.P. scheme no. 61, (Parvat Godadara), final plot no.69 of Vill- Godadara, Tal- Surat City, Dist- Surat. Total Adm. about 420.00sq.ft. (i.e.39.00sq.mtrs.) along with construction thereon. Boundry: North- Adj. Block No. 209, South- Adj. Road, East-Plot no. 189, West-Plot No. 191. Mr. Shyam Becharbhai Bharwad
Rs. 22,00,000.00	2. Mr. Subhash Singh B. Rajput (Guarantor) Add.-3: Rajiv Nagar Zup., Sahara Gate, Surat.	As on 04.02.2022 + Interest thereon	

You are hereby called upon to pay the amounts to Canara Bank as per the details shown in the above table with contracted rate of the interest thereupon from their respective dates and other costs, charges etc., within 60 days from the publication, failing which the undersigned shall be constrained to initiate proceedings, under section 13(4) and section 14 of the SARFAESI Act, against the mortgage properties mentioned herein above to realise the amounts due to Canara Bank. Further you are prohibited under Section 13(13) of the said Act from transferring the said secured assets either by way of sale/lease or otherwise.

Sd/-  
Authorised Officer,  
Canara Bank, Surat.



Regional Stressed Assets Recovery Branch  
Ahmedabad Region II, 2nd Floor, Dena Laxmi Bhavan, Ashram Road, Navrangpura, Ahmedabad-380009.  
Tel- 079 26594234, Email- SARAH@bankofbaroda.com

**E-auction - Sale Notice**

Sale of secured immovable/movable assets under the securitization and reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafter referred to as the Act)

**E-auction Sale Notice for sale of Movable & Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6(2) & Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002.**

Notice is hereby given to the public in general and in particular to the borrower(s) and Guarantor(s) that the below described movable & immovable properties hypothecated/charged to the Bank of Baroda (Erstwhile Dena bank/Erstwhile Vijaya Bank) the possession of which has been taken by the Authorized officer of the Bank of Baroda (Erstwhile Dena bank/Erstwhile Vijaya Bank), secured creditor, will be sold on 04.03.2022 on "As is where is", "As is what is" and "Whatever there is" for recovery of below mentioned accounts. The details of borrower/s / Guarantor/s / Secured Asset/s / Dues/ Reserve price/E auction date & time, EMD and Bid Increase amount are mentioned below.

**Date & Time of E auction: 04.03.2022 from 02.00 PM to 06.00 PM (With unlimited extension of 10 minutes duration each)**

Sr. No.	Branch	Details of Borrower/ Mortgage / Guarantors	Description of the property with known encumbrances	Possession Type	Secured debt for recovery As per Demand notice (Less Recovery made after issuance of 13(2) demand notice Plus interest there)	Reserve Price Earnest Money Deposit Amount	Contact No of the Branch Manager / Authorised officer
1	Gandhi Road	M/s Smruti Creation Mrs. Kalpana Hasumukh Joshi (Prop.), Mr. Mahadev Hiralal Sharma (Guarantor), Mr. Hasumukh Kantilal Joshi (Guarantor)	All that piece and parcel of Immovable property bearing F.P.No.127, Shop No. B-13, Basement Floor, Vijay Plaza, Opp. Transstadia Stadium, Near Kankaria Lake, Kankaria Ahmedabad consisting carpet area of rs.180 sqft.	Symbolic	12.27	Rs. 9.72 Rs. 0.98	Shri Rajesh Sharin 9978446517 Shri Sanjeev Sambyal 7574892034
2	Bhadra	Karankumar Ganpathai Patni & Madhuben Rajeshbhai Patni Madhuben Ganpathai Patni	All the piece & parcel of Residential Flat No. A-2/4, second floor of Block No. A of Abhilasha / Apartment of New Abhilasha co-operative housing society Ltd., Mouje-Asarwa, Taluka-City Ahmedabad-6 (Naroda) admeasuring about 54.35 sq. mtrs. i.e.65 sq.yards.	Symbolic	16.09	Rs. 10.53 Rs. 1.06	Shri Sudershan 9978446507 Shri Sanjeev Sambyal 7574892034

All the taxes/GST as per Govt. Rules applicable shall be payable by the purchaser on sale of immovable assets. For detailed terms & Conditions of sale, Please refer to the link provided in <https://www.bankofbaroda.in/e-auction.htm> and <https://ibapi.in>. Also prospective bidders may contact the authorized officer on above mentioned contact nos.


**Bid Increase amount for all Properties up to Rs.100.00 lakhs is Rs. 10000/- & above Rs. 100.00 lakhs is Rs. 50000/-**

**THIS IS ALSO A STATUTORY 15 DAYS SALE NOTICE UNDER SARFAESI ACT TO THE BORROWER/ GUARANTOR/ MORTGAGOR**

The above mentioned borrower /s/ is/ are hereby notified to pay the sum as mentioned in section 13(2) Notice in full before the date of auction, failing which property will be auctioned / sold and balance dues if any will be recovered with interest and cost from borrowers/guarantors.

Date : 13.02.2022 | Place : Ahmedabad

Sd/- Authorized Officer, BANK OF BARODA



Branch Office : Canara Bank,  
Parle Point Branch, Surat.

**DEMAND NOTICE**

**Notice Under Section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.**  
The Following Borrowers and Co-Borrowers availed the below mentioned secured loans from Canara Bank. The loans of the below mentioned borrowers and co-borrowers have been secured by the mortgage of their respective properties. As they have failed to adhere to terms and conditions of the respective loan agreements and had become irregular, their loan were classified as NPA as per the RBI guidelines. Amount due by them to Canara Bank are mentioned as per respective notices issued more particularly described in the following table and further interest on the said amounts shall also be applicable and the same will be charged as per contractual rate with effect from their respective dates.

Loan A/c No. & Loan Limit Type of Loan	Name of Borrower/Co-Borrower and Guarantor	Demand Notice Date & O/s. Amount Rs.	Details of Immovable Property
A/c No. 7177730003148	1. Mr. Omkar L. Bhargav (Borrower) Add.-1: Flat No. 101 & 103, 1st Floor, Param Residency, Kamrej, Surat-394180.	04.02.2022	Immovable property bearing Flat no. 101 and 103 total adm. about 133.22 sq.mtrs. (flat no. 101 adm. about 66.61 sq.mtrs. and Flat no. 103 adm. about 66.61 sq.mtrs. situated on 1st floor of Building No. D "Param Residency" constructed on land bearing, Block No. 102/A1M to 5 adm. 1301 Sq.mtrs. of Vill-Laskana, Sub Dist.- Kamrej, Dist.- Surat together with proportionate share in the land Mr. Omkar L. Bhargav (Borrower) and Mr. Sumeet Omkar Bhargav (Co-Borrower)
Rs. 13,40,000.00	2. Mr. Sumeet Omkar Bhargav (Co-Borrower) Add.: Flat No. 101 & 103, 1st Floor, Param Residency, Kamrej, Surat-394180.	Rs.12,55,795.08	
Housing Loan	3. Mr. Aakash Nandlal Bhargav (Guarantor) Add.: B/75		

